https://archive.org/details/bk1480/page/n0/mode/1up

All Items on https://archive.org/details/realpatidar

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ નડીઆદ

મું. નડીઆદ. જિ. ખેડા

Full Library on https://realpatidar.com/library

આપણી કેન્દ્રીય સમાજની સ્થાપના એવા વડીલો ધ્વારા કરવામાં આવેલ હતી કે જેમણે પીરાણા સતપંથ ધર્મનો સદંતર ત્યાગ કરી. મુળ સનાતન હિન્દુ ધર્મનો અંગીકાર કર્યો હતો. તેથી નિશંક પણે પુરવાર થાય છે કે આપણી કેન્દ્રિય સમાજ સનાતની સમાજ છે અને તેનો ધર્મ સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે.

શ્રી અ.ભા. ક.ક. પાટીદાર સમાજ (કેન્દ્રિય સમાજ) ન ખત્રાણા દ્વારા તા.૨૫–૩–૨૦૧૦ ના રોજ બહાર પાડેલ શ્વેત પત્ર તેમજ તા. ૭–૫–૨૦૧૦ ની અસાધારણ સામાન્ય સભામાં સર્વાનુમતે બંધારણમાં કરાયેલ સુધારાઓ તથા તા. ૧૨–૫–૨૦૧૦ ના જ્ઞાતિ પંચમ્ અધિવેશનમાં સર્વાનુમતે પસાર કરેલ જ્ઞાતિ રીત રીવાજોની ૧ થી ૨૯ કલમો અને કેન્દ્રિય સમાજે તા. ૧–૭–૨૦૧૦ ના બહાર પાડેલ. આદેશોને અનુલક્ષીને શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ નડિયાદ કેન્દ્રિય સમાજની સભ્ય હોવાથી કેન્દ્રિય સમાજના. કોઈપણ પ્રકારના ઠરાવો કે નીતી નિયમો તથા બહાર પાડવામાં આવેલ આદેશો આપણી સમાજના દરેક સભ્યને ચુસ્તપણે પાળવાની તથા પળાવવાની જવાબદારી બને છે.

સમાજ એટલે . . . .

અ. એક જ ધર્મને(સનાતન વૈદિક હિન્દુ ધર્મ) પાળતો હોય,

બ. એક જ રીત રીવાજને અનુસરતો હોય,

ક. એક જ આચાર–વિચારને વરેલો હોય.

જેથી શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ નડીઆદના દરેક સભ્યોએ નીચે મુજબના ઠરાવોનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

ઠરાવ – ૧ આપણો સમાજનું નામ શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ નડીઆદ રહેશે.

ઠરાવ – ૨ શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ નડીઆદમાં સનાતન વૈદિક હિન્દુ ધર્મને માનતા અને પાળતા વ્યકિત જ સભ્યપદ લઈ શકશે (પીરાણા સતપંથ ધર્મને માનતી અને અનુસરતી કોઈપણ વ્યકિત આ સમાજની સભ્ય બની શકશે નહિં) આ સમાજના કોઈપણ સભ્યએ એમના બાહ્ય આચરણો જન્મથી મરણોતર સુધી હિન્દુ તરીકેના પાળવાના રહેશે. પીરાણા સતપંથ ધર્મના કોઈપણ સ્થળોએ દર્શન પુજા અર્ચના કરવી અથવા તો રૂપિયા આપી પુજા કરાવવી પિરાણા

realpatidar.com

https://archive.org/details/bk1480/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com - Created using: Create-D-File-Step2.pyw (v51)
Created on: 2026-04-11T18:34:14

https://archive.org/details/bk1480/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.04.11 18:34:20 +05'30'

Real Patidar
Unravel Truth

realpatidar.com

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ નડીઆદ

મું. નડીઆદ. જિ. ખેડા

આપણી કેન્દ્રીય સમાજની સ્થાપના એવા વડીલો ધ્વારા કરવામાં આવેલ હતી કે જેમણે પીરાણ સતપંથ ધર્મનો સદંતર ત્યાગ કરી. મુળ સનાતન હિન્દુ ધર્મનો અંગીકાર કર્યો હતો. તેથી નિશંક પણે પુરવાર થાય છે કે આપણી કેન્દ્રિય સમાજ સનાતની સમાજ છે અને તેનો ધર્મ સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે.

શ્રી અ.ભા. ક.ક. પાટીદાર સમાજ (કેન્દ્રિય સમાજ) ન ખત્રાણા દ્વારા તા.૨૫–૩–૨૦૧૦ ના રોજ બહાર પાડેલ શ્વેત પત્ર તેમજ તા. ૭–૫–૨૦૧૦ ની અસાધારણ સામાન્ય સભામાં સર્વાનુમતે બંધારણમાં કરાયેલ સુધારાઓ તથા તા. ૧૨–૫–૨૦૧૦ ના જ્ઞાતિ પંચમ્ અધિવેશનમાં સર્વાનુમતે પસાર કરેલ જ્ઞાતિ રીત રીવાજોની ૧ થી ૨૯ કલમો અને કેન્દ્રિય સમાજે તા. ૧–૭–૨૦૧૦ ના બહાર પાડેલ. આદેશોને અનુલક્ષીને શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ નડિયાદ કેન્દ્રિય સમાજની સભ્ય હોવાથી કેન્દ્રિય સમાજના કોઈપણ પ્રકારના ઠરાવો કે નીતી નિયમો તથા બહાર પાડવામાં આવેલ આદેશો આપણી સમાજના દરેક સભ્યને ચુસ્તપણે પાળવાની તથા પળાવવાની જવાબદારી બને છે.

સમાજ એટલે................

અ. એક જ ધર્મને(સનાતન વૈદિક હિન્દુ ધર્મ) પાળતો હોય,
બ. એક જ રીત રીવાજને અનુસરતો હોય,
ક. એક જ આચાર–વિચારને વરેલો હોય.

જેથી શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ નડીઆદના દરેક સભ્યોએ નીચે મુજબના ઠરાવોનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

ઠરાવ – ૧ આપણો સમાજનું નામ શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ નડીઆદ રહેશે.

ઠરાવ – ૨ શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ નડીઆદમાં સનાતન વૈદિક હિન્દુ ધર્મને માનતા અને પાળતા વ્યકિત જ સભ્યપદ લઈ શકશે (પીરાણા સતપંથ ધર્મને માનતી અને અનુસરતી કોઈપણ વ્યકિત આ સમાજની સભ્ય બની શકશે નહિં) આ સમાજના કોઈપણ સભ્યએ એમના બાહ્ય આચરણો જન્મથી મરણોતર સુધી હિન્દુ તરીકેના પાળવાના રહેશે. પીરાણા સતપંથ ધર્મના કોઈપણ સ્થળોએ દર્શન પુજા અર્ચના કરવી અથવા તો રૂપિયા આપી પુજા કરાવવી પિરાણા

realpatidar.com

realpatidar.com

સ્થાનકે બેડીઓ પહેરવી અથવા તો મરણ પાછળ પીરાણા જઈ ગુનો છોડાવવો નારાયણ બલી ચડાવવી પીરાણા સતપંથ ધર્મના કોઈપણ ધાર્મિક સ્થળોએ જવા માટે યોજાતી પદયાત્રા સંઘમાં ભાગ લેવો અથવા પીરાણા સંસ્થાઓ ધ્વારા ભરાતી શીબીરોમાં ભાગ લેવો અથવા તેના જેવી વિવિધ ક્રિયાઓ તેમજ દાન, ભેટ સોગાદ મોકલવી. ધંધાના સ્થળે તથા પોતાના ઘરે પીરાણા પંથના ગુરૂની છબી તથા યંત્ર કે ચિન્હ કે પ્રતિકો મુકવા એવી તમામ ક્રિયાઓ કરવી અથવા કરાવવી તેને હિન્દુના બાહ્ય આચરણો ગણવામાં આવશે નહી. તેવા બાહ્ય આચરણ કરવાવાળા અથવા તો કરાવવાવાળા આ સમાજના સભ્ય રહી શકશે નહિ. ઉપરોકત મુદદાને અનુલક્ષીને શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ નડિઆદના તમામ પરિવારોએ પિરાણા સતપંથ ધર્મમાં કરવામાં આવતી દફનની મરણોતર ક્રિયાઓમાં ભાગ લેવો નહી. તથા તેને લગતી કોઈપણ ધાર્મિક ક્રિયા કર્મ અથવા તો જમણવારમાં હાજરી આપવી નહિ અને આવા કાર્યોને સદંતર બહિષ્કાર કરવો પીરાણા પંથના કોઈપણ સ્થળોએ જેવા કે પિરાણા, કાદિયા, નખત્રાણા વગેરે અને કોઈપણ ગામના જયોતિધામ અથવા કહેવાતા નિષ્કલંકી નારાયણના સ્થાનકમાં દર્શન–પુજા–અર્ચના કરવી નહિ. કોઈપણ પ્રકારના લાગા–દાન–ભેટ સોગાદ આપવી કે મોકલવી નહી.

ઠરાવ – ૩ આ સમાજની કોઈપણ વ્યકિતએ પીરાણા સતપંથ ધર્મની સમાજોના ધાર્મિક ઉત્સવો કે તેના ધ્વારા થતા સામૈયાઓમાં તેમજ સતસંગ કે ધાર્મિક સભાઓમાં ભાગ લેવો નહી અથવા તે અંગેનો જમણવાર ના આમંત્રણનો સ્વીકાર કરવો નહી.
આપણી સમાજના ધાર્મિક હિન્દુ ઉત્સવો જેવા કે રામનવમી, જન્માષ્ટમી, નવરાત્રી, સતસંગ કે પ્રતિષ્ઠા મહોત્સવ તિથી કે તેને લગતા સમહ ભોજનના કાર્યક્રમોમાં પિરાણા સતપંથ ધર્મને માનતી અનુસરતી વ્યકિત તેમજ પરિવાર તેમજ વ્યકિત – સમુહને કોઈપણ પ્રકારનું આમંત્રણ આપવું નહી.

ઠરાવ – ૪ શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ નડિયાદના કોઈપણ સભ્યએ અથવા પરિવારે આજદિવસ પછી દિકરા–દિકરીઓના સગપણ – સાંતરા બાબતે દિકરી લેવાનું તથા દિકરી દેવાનું સનાતન ધર્મ પાળનારા પરિવારો સાથે જ કરવાનું રહેશે.

આપણી સનાતન સમાજના ભાઈઓ વહેવારીક પ્રસંગોમાં અને કુટુંબીક વહેવારમા જેવા કે લગ્ન–મરણ કે જન્મ પ્રસંગોએ જેમના લગ્ન – જન્મ કે મરણ થયા હોય તે વ્યકિતના દાદાના સગાભાઈ સુધીનો પરિવાર તે પ્રસંગમાં જઈ શકશે. જુના સંબંધો ટકાવી રાખવા માટે જાતે ઉચીત નિર્ણય લેવાનો રહેશે.

realpatidar.com

https://archive.org/details/bk1480/page/n4/mode/1up

realpatidar.com

ઠરાવ – ૫ આપણા સમાજના સભ્યો પીરાણા સતપંથ ધર્મને માનનાર અથવા અનુસરતા હોય તેની સાથે કોઈપણ જાતનો સંબંધ રાખી શકશે નહી. કોઈપણ વ્યક્તિ કે પરિવાર મધરાતની પુંજા તથા પિરાણા પંથ ધર્મની ક્રિયા કર્મ કરવી અથવા કરાવી શકશે નહી.

પિરાણા સતપંથ ધર્મની કોઈપણ સંસ્થાના કહેવાતા સંતો, દાસો ધર્મગુરૂઓ, આચાર્યો વગેરેને પોતાના ઘરે બોલાવી શકશે નહી. અને આવા યોજાતા કોઈપણ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહી.

ઠરાવ – ૬ શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ નડીઆદમાં પિરાણા સતપંથ ધર્મને માનનાર વ્યક્તિ અથવા પરિવાર આ સમાજનો સભ્ય અથવા તો હોદેદાર હશે તો તેનું સભ્યપદ અથવા તો હોદો આપોઆપ રદ થયેલો ગણાશે.

સ[illegible]રીકે રદ થયેલ કોઈપણ સભ્યએ સમાજમાં ભરેલ કોઈપણ રકમ કે લવાજમ પાછુ આપવામાં આવશે નહી અને તેવા સભ્યનો કોઈપણ પ્રકારનો દાવો સમાજ પર રહેશે નહી.

ઠરાવ – ૭ આપણી સમાજના કોઈપણ સભ્ય કે પરિવાર પિરાણા સતપંથ ધર્મને માનનાર વ્યકિતને સો મીલ દુકાનો તથા ધંધાના કોઈપણ સ્થળો ભાડે કે અન્ય પ્રકારે આપી શકશે નહી અને આપેલ હોય તો ટુંક સમયમાં પરત લઈ લેવાના રહેશે અને પિરાણા સતપંથ ધર્મને માનનાર સભ્યની મિલકત ભાડે કે અન્ય પ્રકારે લેવી નહી.

ઠરાવ – ૮ ઉપરોક્ત ઠરાવોનું પાલન કરવા તેમજ કરાવવા માટે સમાજના દરેક પરિવારોની નૈતિક ફરજ બને છે. તેથી દરેક પરિવારે સમાજને પોતાના ૧૮ વર્ષ થી ઉપરના દરેક સભ્યોએ ઠરાવો પાળવાની બાંહેધરી રૂપે સહીઓ કરવાની રહેશે તથા ૧૮ વર્ષ થી ઉપરના દરેક સભ્યોએ કેન્દ્રિય સમાજના આજીવન સભ્ય બનવાનુ રહેશે.

ઠરાવ – ૯ ઉપરોક્ત ઠરાવોને લાગુ પાડવા માટે સમાજ બંધારણમાં જોઈતા ફેરફાર કરવા માટે સર્વાનુમતે ઠરાવે છે.

ઠરાવોની એકપ્રત (નકલ) કેન્દ્રીય સમાજમાં તથા તેના અંતર્ગત મધ્યગુજરાત ઝોનને [illegible] મોકલવામાં આવે અને આજુબાજુની સનાતન સમાજોને પણ ઠરાવોની નકલો મોકલવામાં આવે ઉપરોકત ઠરાવોનું પાલન દરેક પરિવારોએ કરવાનું રહેશે. જેમાં કોઈપણ પ્રકારની ઢીલાસ ચુક અથવા બાંધછોડ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ. ઠરાવોનું ઉલ્લંઘન કરનાર આ સમાજના

realpatidar.com

https://archive.org/details/bk1480/page/n5/mode/1up

realpatidar.com

ગુનેગાર ગણાશે અને તેવા સભ્યનું / પરિવારનું સભ્યપદ રદ કરવામાં આવશે અને તે બાબતે બીજી કોઈપણ અન્ય ચર્ચાઓ હાથ ધરવામાં આવશે નહી.

ઠરાવ – ૧૦ શ્રી કચ્છ કડવા પાટીદાર સમુહ લગ્ન આયોજન સમીતી નડિઆદની ગત તા.૨૩–૯–૨૦૧૦ ના મળેલ મીટીંગમાં થયેલ ઠરાવ મુજબ લગ્નમાં ભાગ લેનાર દરેક સભ્ય સનાતન સમાજના નિયમોને પાળનાર હોવો જરૂરી છે. જેથી આપણે સનાતનના નિયમોને પાળનાર સભ્યો અને સગાવ્હાલાની જ જવાબદારી લેવાની રહેશે. પિરાણા પંથના ધર્મને પાળનાર સગા–સંબંધી કે સમાજના સભ્યની બાંહેધરી (ભલામણ) કરવાની રહેશે નહિ.

ઉપરોક્ત ઠરાવો સમાજની સામાન્ય સભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવે છે અને તે તા. ૨૪/૧૦/૨૦૧૦થી લાગુ પાડવામાં આવે છે.

નડિયાદ

તા. ૨૪/૧૦/૨૦૧૦

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ
નડિયાદ

પટેલ પુરુષોત્તમ પ્રેમજી વાસાણી

પ્રમુખ મહામંત્રી

પટેલ શિવજીભાઈ રામજીભાઈ

ફર્મનુ નામ...

સભ્યનુ નામ . સહી

૧ ....
૨ ....
૩ ....
૪ ....
૫ ....
૬ ....
૭ ....
૮ ....
૯ ....
૧૦ ....

૪

realpatidar.com